

06 ફેબ્રુઆરી 2019

## બ્રમ્પટન ખાતે કેનાબિસના સૂચિત રિટેઇલ સ્ટોરનું ઠેકાણું

બ્રમ્પટન ખાતે કેનાબિસના સૂચિત રિટેઇલ સ્ટોરની વિગતો અલ્કોહોલ એન્ડ ગેમિંગ કમિશન ઓફ ઓન્ટારિયો (Alcohol and Gaming Commission of Ontario (AGCO)) દ્વારા તેઓના [iAGCO](#) પોર્ટલ પર ઉપલબ્ધ કરવામાં આવી છે

સ્ટોરનું સૂચિત ઠેકાણું 186 મેઇન સ્ટ્રીટ સાઉથ, સ્વીટ 190, બ્રમ્પટન, ઓન્ટારિયો L6W 2E2. AGCO 15-દિવસનો જાહેર અધિસૂચનાનો સમયગાળો સુલભ કરશે. જો બ્રમ્પટનનાં નાગરિકોએ સ્ટોરના ઠેકાણા વિશે કોઈ પણ મત દર્શાવવા હોય તો [iAGCO](#) પોર્ટલ મારફત સીધા પૂરા પાડી શકાશે. લેખિત રજૂઆતોની અંતિમ તારીખ 20 ફેબ્રુઆરી 2019 છે. લેખિત રજૂઆતોની વધુ વિગતો [અહીં](#) મળી શકશે.

### વારંવાર પૂછાતા પ્રશ્નો

શું બ્રમ્પટન ખાતે કેનાબિસના રિટેઇલ સ્ટોર કાયદેસર છે?

હા, 21 જાન્યુઆરી 2019ના રોજ [બ્રમ્પટન સીટી કાઉન્સિલે](#) ખાનગી માલિકીના કેનાબિસ રિટેઇલ સ્ટોર્સ બ્રમ્પટનમાં ખુલે તેનાં પક્ષમાં મત આપ્યો છે. સ્ટોર્સનું નિયમન અને તેઓને પરવાના AGCO દ્વારા જરી થશે.

શું સીટી ઓફ બ્રમ્પટન કેનાબિસના બ્રમ્પટન ખાતેના તમામ સૂચિત રિટેઇલ સ્ટોર્સ માટે જાહેર અધિસૂચના જરી કરશે?

ના, સીટી ઓફ બ્રમ્પટન જાહેર અધિસૂચના જરી કરશે નહીં. તે પ્રક્રિયાનું સંચાલન AGCO દ્વારા થાય છે. કૃપા કરીને [જાહેર અધિસૂચના પ્રક્રિયા](#) માટે તેઓની વેબસાઇટ જુઓ.

કેનાબિસના નવા રિટેઇલ સ્ટોરની અરજી વિશે હું કેવી રીતે માહિતગાર રહી શકું?

કેનાબિસ વિશેના નિયમો અંગેની અને લાયસન્સ પ્રક્રિયાની માહિતી ઉપલબ્ધ થશે ત્યારે AGCO તે વહેંચશે. [અપડેટ મેળવવા માટે AGCO ની ઈમેલ લિસ્ટમાં નોંધણી કરો.](#)

બ્રમ્પટન ખાતે કેનાબિસના સૂચિત રિટેઇલ સ્ટોરના ઠેકાણા વિશે શું જાહેર જનતા સીટીને પ્રતિભાવ આપી શકે?

જનતાને સલાહ આપવામાં આવે છે કે પ્રતિભાવ સીધો AGCOને [iAGCO](#) પોર્ટલ પર આપવો. લેખિત રજૂઆત ફાઇલ કરવા અંગેની વધુ માહિતી AGCO [કેનાબિસ રજૂઆત પાન \(Cannabis Submission Page\)](#) પર ઉપલબ્ધ છે.

શું કેનાબિસના રિટેઇલ સ્ટોર્સ દ્વારા શાળાઓથી અમુક અંતર રાખવાનું રહેશે?

હા, કાયદેસર રિટેઇલ સ્ટોર્સ દ્વારા શાળાઓથી ઓછામાં ઓછું 150 મીટરનું અંતર રાખવાની આવશ્યકતા રહેશે. અંતર મર્યાદાના આધારે એવી મિલકતો જેમને છૂટક દુકાનો બનાવવાની મંજૂરી મળેલ ક્ષેત્રો બનાવવામાં આવ્યા હોય તે [સીટી વેબસાઇટ પર ઉપલબ્ધ આ નક્શા](#) પર ડાઇલાઇટ કરવામાં આવ્યા છે. વોર્ડ માટેના વિશિષ્ટ નક્શા [આ વેબપેજ](#) પર પણ ઉપલબ્ધ છે.

-30-

**मिडिया संपर्क:**

मोनिका दुग्गल

कोऑर्डिनेटर, मिडिया ऐन्ड कम्युनिटी एंगेजमेन्ट

पब्लिसिटी संवाहक

सीटी ओफ़ ब्राम्पटन

905-874-3426 | [Monika.Duggal@brampton.ca](mailto:Monika.Duggal@brampton.ca)